

Super Visa/ Visitor to Canada Insurance

Best Mortgage Rates
1st and 2nd Mortgages
Life and Critical Illness Insurance
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
mukund@pyramidfinancial.ca

Serving at 2 locations
GTA East / GTA West
Investment | Insurance | Mortgages

परदेशां देशनी महेंक अटले

स्वदेश

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH

WTC झार्नल: पांचमांथी चार दिवस
वरसादना विधननी आगाडी

PAGE NO. 19

FRIDAY, 18 JUNE, 2021 Vol. 18, No. 25 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

कोरोना
बीज
लहर

आर्थिक उपार्जनमां रुपिया 2 लाख करोडनां नुकसाननी संभापना : RBI

लोकडाउन अने नाना शहरो तथा गाभोमां कोरोना कारणे विविध चीजवस्तुनी भागमां मोटो घटाडो थयो

मुंभ

भारतीय रिजर्व बेन्कना अेक अंदाज प्रमाणे कोरोनाना सेकन्ड वेवना कारणे थालु नाझाकीय वर्षमां आर्थिक उपार्जनमां रुपिया बे लाख करोडनुं नुकसान थई शके ऐ. रिजर्व बेन्क द्वारा नुकसाननो अंदाज मांडवा संभवित आ प्रकारनी सौप्रथम क्वायत डाय धराई डती. जून २०२१ना मासिक बुलेटिनमां रिजर्व बेन्के जझाव्युं ऐ के राजयो द्वारा लादवामां आवेला लोकडाउन अने नाना शहरो तथा गाभोमां कोरोनाना प्रसारना कारणे ग्रामीण भागमां मोटो घटाडो थयो ऐ. आर्थिक उपार्जनमां नुकसानने जडीपी साथे सीधो कोई संबंध नथी परंतु अर्थतंत्रमां नुकसाननो उमेरो तो करे ज ऐ. भारतीय अर्थतंत्रनी स्थिति पर रिजर्व बेन्के जझाव्युं डतुं के, कोरोनाना सेकन्ड वेवना कारणे घरेलु भागमां घटाडो थयो ऐ अने भारतीय अर्थतंत्र कोरोनाना सेकन्ड वेव सामे संघर्ष करी रह्युं ऐ तेम छतां कृषि अने संपर्क कर्था विनानी सेवाओ यथावत ऐ ज्यारे औद्योगिक उत्पादन अने निकास वधी रह्यां ऐ. रिजर्व बेन्के जझाव्युं डतुं के, वेक्सिनेशननी ङडप अने व्याप अर्थतंत्रमां रिक्वरीनो मार्ग कंडारशे. भारतीय



अर्थतंत्र कोरोना महामारीनी असरोमांथी बाउन्स बेक करशे.

बीजतरक स्वीस ओकरेज युबीएस सिक्युरिटीजना रिपोर्टमां जझाववामां आव्युं ऐ के, अप्रिल अने मे महिनामां राजयो द्वारा लादवामां आवेला लोकडाउनना कारणे वर्ष २०२१-२२ना नाझाकीय वर्षना प्रथम त्रिमासिकमां भारतीय अर्थतंत्रमां १२ टकानो घटाडो थयो ऐ. वर्ष २०२०ना आज समयगाणामां भारतीय अर्थतंत्रमां २३.८ टकानो घटाडो थयो डतो. तेनो अर्थ ऐ थयो के भारतीय अर्थतंत्रमां गया वर्षनी जेम वी शेप रिक्वरी थई रडी नथी.

सत्या नादेलाने मण्युं प्रमोशन, माईकोसोफ्टना येरमेन बन्या पूर्व येरमेन थॉम्पसन हवे प्रमुभ ईन्डिपेन्डेन्ट डायरेक्टर रडेशे

वोशिंगटन

माईकोसोफ्टना भारतीय मूणना सीईओ सत्या नादेलाने सङ्गतानी सीडी पर आगण वधी रह्या ऐ. माईकोसोफ्ट कंपनीऐ हवे तेमने पोताना येरमेन बनावी दीधा ऐ अने नादेलाने हवे जॉन थॉम्पसननुं स्थान लेशे.

उल्लेखनीय ऐ के, सत्या नादेलाने २०१४ना वर्षमां माईकोसोफ्टना मुष्य कार्यकारी अधिकारी (सीईओ) बन्या डता. त्यार बाद LinkedIn, Nuance कोम्युनिकेशन्स अने ZeniMax जेवी अनेक कंपनीओना अबजो डोलरना अधिग्रहणमां तेमणे मदतनी भूमिका लजवी डती. कंपनीना कडेवा प्रमाणे थॉम्पसन हवे प्रमुभ ईन्डिपेन्डेन्ट डायरेक्टर रडेशे. २०१४ना वर्षमां थॉम्पसन बिल गेट्स बाद माईकोसोफ्टना येरमेन बन्या डता. माईकोसोफ्टना संस्थापक बिल गेट्स हवे



कंपनीना बोर्डमां नथी अने तेओ बिल अने मेलिन्डा गेट्सना परोपकारी कार्यो पर ध्यान आपी रह्या ऐ. कंपनीऐ ताजेतरमां ज प्रति शेर ५६ सेन्टनो त्रिमासिक लाभांश आपवानो निर्णय लीधो ऐ. भारतमां कोरोनाना कारणे थई रडेला विनाशना कारणे माईकोसोफ्टना सीईओ सत्या नादेलाने पञ्ज भूष डुभी डता. तेमणे आ स्थितिमां महदनी विश्वास आप्यो डतो.

अदाशीनी मार्केट केप ४ दिवसमां आशरे ३.१.५८ लाख करोड घटी

नवी दिल्ली

अदाशी ग्रूपनी कंपनीओनां शेरमां सोमवारे मोटापाये कडाको जेवामां आव्या पछी ऐल्ला चार दिवसमां कंपनीनी मार्केट केप आशरे १.५८ लाख करोड रुपिया घटी गई ऐ. सतत योथा दिवसे अदाशी पावर, अदाशी टोटल गेस अने अदाशी ट्रांसमिशनमां पांच टकानुं लोअर ट्रेडिंग जेवा मण्युं डतुं. बीज बाजु अबजोनी संपत्ति घटया पछी गौतम अदाशीऐ अेशियामां बीज कम्पनी धनिकनो दरज्जे गुमाव्यो डोवाना अडेवाल ऐ. आ अठवाडये आप्पा विश्वमां अन्य कोई धनिकनी सरभामझीमां तेमनी संपत्तिमां मोटुं गाभरुं पड्युं डतुं. षडुमभर्ग बिलियोनर ईन्डेक्सनां जझाव्या मुजब सोमवारथी बुधवार

सुधीना त्रण दिवसमां तेमनी संपत्तिमां ८ अबज डोलरनो अने अेकला बुधवारे ४ अबज डोलरनो घटाडो थयो डतो. आ पछी तेमनी नेटवर्थ ६७.६ अबज डोलर थई गई ऐ. आने कारणे चीननां उद्योगपति जॉंग शानशुन इरी अेशियानां बीज कम्पनी धनिक थई गया ऐ. तेमनी संपत्ति ६८.४ अबज डोलर ऐ. गौतम अदाशी त्रीज कमे धकेलाई गया ऐ.

ABOWATH REAL ESTATE GROUP

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More Info on PAGE 2
वधु भाडिती पानुं २ पड

ABOWATH.COM

ऐल्ला ४४ वर्षथी टैरान्टीनी सर्व प्रथम गुजराती ट्रावेल अेजन्सी. ४४ वर्षथी गुजराती प्रज्ज अने गुजराती भाषा अमारी सङ्गता माटे यज्ञभागी ऐ. दिल्ली आपनी अमे भूज आभार मानीऐ छीऐ. स्वाई मुसाहरी नी टीकीट माटे अमारा भाव टैरान्टीमां भूज आकर्षक ऐ अजमावी बुओ... आपने आनंद थरे.

Ashok Travels 416-977-9896 अशोक ट्रावल्स ४१६ ९७७ ९८९६

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com

Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

SUPER VISA INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Residential
New Condos
Investments
Commercial

दुसामां याए सभरो
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX
COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

કેનેડામાં કોરોનાના વળતાં પાથી, નવા 837 કેસ, 8ના મોત

સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13623 રહી, 670 દર્દીઓની હાલત અત્યંત નાજૂક

ઓન્ટેરિયો : કેનેડામાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે સમગ્ર દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 837 રહી હતી. જ્યારે કોરોનાને કારણે મોતને ભેટનારાઓની સંખ્યા 8 નોંધાઈ હતી. ગુરુવારે કેનેડામાં સૌથી વધુ ઓન્ટેરિયોમાં 370 નાગરિકો વાયરસની ચપેટમાં આવવા સાથે અહીં 7 દર્દીના મોત થયા હતા. જ્યારે ક્યૂબેકમાં નવા 161 કેસ મળ્યા હતા. અહીં દિવસ દરમિયાન કોરોનાથી એક દર્દી મોતને ભેટ્યો હતો.

આ ઉપરાંત મોનીટોબામાં નવા 183 કોરોના સંક્રમિતો મળી આવ્યા હતા. અને એક મોત થયું હતું. સાસ્કેચવાનમાં નવા 94 નાગરિકોમાં કોરોના વાયરસની પૃષ્ઠિ થઈ હતી. જ્યારે નોવા સ્કોશિયામાં નવા 14 દર્દી નોંધાયા હતા અને 9 દર્દી કોરોનાને માત આપી સાજા થયા હતા. કેનેડામાં ગુરુવારે સાંજની સ્થિતિએ એક્ટિવ કેસની સંખ્યા 13623 રહી હતી. જ્યારે 670 દર્દીઓની હાલત અત્યંત નાજૂક હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગુરુવારે સમગ્ર દેશમાં 1354 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ડેલ્ટા વેરીયન્ટને અટકાવવા વેક્સીન ભારે અસરકારક : અભ્યાસ

અન્ય વાઈરસની સરખામણીમાં ડેલ્ટા વેરીયન્ટની સંક્રમકતા 60 ટકા વધુ હોવાનો દાવો

ટોરોન્ટો : નોવેલ કોરોના વાઈરસના ડેલ્ટા વેરીયન્ટ જે વિશ્વના ૭૪ દેશોમાં જોવા મળ્યો છે એના સંક્રમણના વધવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે એક અભ્યાસનું તારણ જાહેર થયું છે એ મુજબ સંક્રમણ અન્ય વાઈરસની સરખામણીમાં ૬૦ ટકા વધી શકે છે. આ કારણે જ યુકેએ અનલોક કરવાની તારીખ હવે ૧૯મી જુલાઈ સુધી લંબાવી છે. આ તારણ સ્કોટલેન્ડના અભ્યાસનું છે. યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે, અમે આ વેરીયન્ટના કેસોમાં દર અઠવાડિયે દર ટકાનો વધારો જોઈ રહ્યા છીએ. આવી જ વધારો ભારતમાં મે માસમાં જોવા મળ્યો હતો. જે ડેલ્ટા વેરીયન્ટને કારણે જ થયો હતો. કેનેડામાં આ વેરીયન્ટનું કલચર એલબર્ટામાં છે. જ્યાં

વેક્સીન બમણી ઝડપે અપાઈ હોવા છતાં ૧૦ જણાને ચેપ લાગ્યો છે. એલબર્ટાના યુનાઈટેડ નર્સિસના વાઈસ પ્રેસિડેન્ટ ડો. બર્બરા ચાફેએ કહ્યું હતું કે, વધતા સંક્રમણથી સ્ટાફ ચિંતામાં છે. ૧૬મી મેથી ૨૩મી જુન દરમિયાન ડેલ્ટા વેરીયન્ટના સંક્રમણનો દર ૧૪ ટકા જ જોવા મળ્યો હતો. જે આલ્ફા વેરીયન્ટના સંક્રમણ કરતા દોઢ ગણો છે. તેમણે કહ્યું હતું કે એક અભ્યાસ મુજબ ડેલ્ટા વેરીયન્ટ સામે પહેલા ડોઝમાં એસ્ટ્રા ઝેન્કા વેક્સીનની અસરકારકતા ૭૧ ટકા જોવા મળી હતી. જ્યારે ફાઈઝરની અસરકારકતા ૯૧ ટકા છે. એ રીતે જ બીજા ડોઝ બાદ એસ્ટ્રાઝેન્કાની અસરકારકતા ૯૨ ટકા અને ફાઈઝરની અસરકારકતા ૯૬ ટકા જોવા મળી હતી.

ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસિસાગાની વર્ચ્યુઅલ મીટીંગ



ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસિસાગા સંસ્થાની મીટીંગ ઝૂમ પર યોજવામાં આવી હતી. જેમાં પંકજભાઈ મહેતા, મહેન્દ્રભાઈ દ્વારા પ્રાર્થના થયા બાદ સુધાબેન ભટ્ટે કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. સંસ્થાના પ્રમુખ કલાબેન પટેલે બધાને શુભેચ્છા આપતા આવનાર સભ્યોની હાજરી જોઈ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જ નવા આવેલા સભ્યોની ઓળખ આપી તેનું સંસ્થા વતી સ્વાગત કર્યું હતું. નવા યોજાતા કાર્યક્રમો માટે સંસ્થાને વોલેન્ટિયરની આવશ્યકતા હોવાની જાહેરાત આ તકે કરાઈ હતી.

સાથે જ ગવર્નમેંટ તરફથી નાના ગ્રુપ દ્વારા થતાં આયોજનને મંજૂરી અપાઈ હોવાથી કનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 12 સપ્ટેમ્બરના રોજ વોકેશન, પિકનિક તથા ૫ સપ્ટેમ્બરે કેમ્પનું આયોજન કરવાની વિગતો આપવામાં આવી હતી. આ આયોજન માટે મુકેશભાઈ ગાજરીયા તથા શ્રીકાંતભાઈ ગાંધીને જવાબદારી સોંપાઈ હતી.

જેમણે એક અથવા બે વેક્સીનના ડોઝ લીધા હોય તેમને જ કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થવા પરવાનગી અપાશે. તેથી આવા લોકોએ પ્રવીણભાઈ મહેતાની સંસ્થા તરફથી આવેલા ઈ-મેલમાં ફોર્મની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ ભારતીયેન ગાંધીએ બધાને હાસ્યના ટુચકા કહી તથા હાસ્ય કાર્યક્રમ રજૂ કર્યો હતો. હનુમાન ચાલીસા તથા રંગલા રાસ દ્વારા અને બોલીફીટ કસરત કરાવી બધાને તેઓ સ્ફૂર્તિમાં લાવ્યા હતા.

ટ્રેઝરર જયેશભાઈ મહેતાએ જણાવ્યું કે હજુ 170 સભ્યોએ ફી ભરી નથી. 353 સભ્યોએ ફી ભરી દીધી છે. હવે ૩ ૧જુલાઈ બાદ પેનલ્ટી માટે \$૭૫ ભરવા પડશે. સુધાબેન ભટ્ટે, આ માસમાં જેની બર્થડે આવતી હોય તેની વર્ષગાંઠ નિમિત્તે ફોટો મુકવા સાથે બર્થડે સોન્ગ રજૂ કરાયું હતું. ત્યારબાદ સંસ્થાના જ ગાયકો દ્વારા કરિઓકીનો કાર્યક્રમ રજૂ કરાયો હતો. જેનું સંચાલન મહેન્દ્રભાઈ ગાંધીયાએ કર્યું હતું.

ઓન્ટેરિયોની કંપની યુઝડ કારનો ઓર્ડર આપો કે તરત જ હોમ ડીલીવરી આપશે..!

વાહન અનુકૂળ નહીં આવે તો અઠવાડિયામાં પરત લઈ જવા પણ ખાતરી અપાશે

ટોરોન્ટો : મહામારી દરમિયાન ઘણાં લોકોએ ઓનલાઈન શોપિંગનો પ્રયોગ કર્યો હશે. પરંતુ તમારો ઓર્ડર પુરો થઈ તમને તમારી પસંદની ચીજ વસ્તુ ઘરબેઠાં મળે એમાં કદાચ એક કે બે દિવસ લાગી જતા હતા. પણ હવે એક ઓનલાઈન કાર કંપની તમારી પસંદની યુઝડ કાર ઓર્ડર કરો એ જ દિવસે ઘરબેઠાં પહોંચાડવાની ખાતરી આપી રહી છે. વળી એક અઠવાડિયાની ફી ટ્રાયલ પણ આપે છે. એટલે કે જો તમને એ વાહન અનુકૂળ ન આવે તો પરત લેવાની ખાતરી પણ આપે છે. કેનેડા ડ્રાઈવ્સ નામક આ ઓનલાઈન કંપની ઓન્ટેરિયોમાં

તાજેતરમાં શરૂ થઈ છે. જે તમને ઓર્ડર આપો એ જ દિવસે ડીલીવરી આપવાની ખાતરી આપે છે. વળી સાત દિવસમાં મની બેકની ગેરન્ટી પણ આપે છે. મીડિયાને આપેલી મુલાકાતમાં કેનેડા ડ્રાઈવ્સના સ્થાપક કોડી ગ્રીને કહ્યું હતું કે, જ્યારે તમે સાત દિવસ માટે એ વાહનનો ઉપયોગ કરો છો ત્યારે તમને ખબર પડી જાય કે એ વાહન તમને અનુકૂળ છે કે નહીં. પહેલું ઓનલાઈન કાર શોપિંગ પ્લેટફોર્મ બ્રિટીશ કોલંબિયામાં ગઈ પાનખરમાં શરૂ થયું હતું. એણે ઓન્ટેરિયોમાં આ સિસ્ટમ ગત અઠવાડિયે શરૂ કરી છે.

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects *plus* your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

MOHAMMAD ABOWATH SALES REPRESENTATIVE | MAAZ ABOWATH BROKER | IBRAHIM ABOWATH SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX #SellWithABOWATH your Local REALTOR

*Not intended to Solicit client under contract.

SHIV FINANCIAL SERVICES

VISITOR TO CANADA AND NEW IMMIGRANTS INSURANCE

Personal Tax - File is Free For New Immigrants.

Full Time Service Provider

Serving Community Since 2009

- Life Insurance, Critical Illness Insurance & Mortgage Insurance with Money Back Option • Health & Dental Plan
- Segregated Fund • Personal Tax-file

* અમે બધી ટોપની ઇન્સ્યુરન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.
* New Life Insurance Advisors are recruited.

જગદીશ સેવક (Financial Advisor)
Cell: 647-236-7620

For Free Quotation & Consultation

SHIV FINANCIAL SERVICES
"Proper insurance coverage is Peace of Mind"
Email: sevak_2007@hotmail.com
www.shivfinancialservices.ca

GUARANTEED LOWEST PREMIUM



તંત્રી સ્થાનેથી

રામલલા મંદિર ટ્રસ્ટ વિવાદમાં: 2 કરોડની જમીન 18 કરોડમાં ખરીદી

અયોધ્યામાં રામલલાના મંદિરના નિર્માણ પહેલાં જ મોટો વિવાદ ઉભો થયો છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી



તંત્રી - પ્રકાશક
સ્વદેશ

યોજવાની હિલચાલ વચ્ચે રામમંદિર માટે જમીન સંપાદનમાં બે કરોડની જમીન ૧૧ જ મિનિટનમાં ૧૮.૫ કરોડમાં ખરીદાઈ હોવાનો આરોપ ઉઠતા ભૂકંપ જેવી સ્થિતિ ઊભી થઈ છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પવન પાંડેએ આક્ષેપ કર્યો છે કે, રામ મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે જમીનની ખરીદીમાં કરોડો રૂપિયાનાં કોઠાં-કબાડાં કર્યાં છે. પાંડેના આક્ષેપ પ્રમાણે એક જમીન મૂળ માલિક પાસેથી માત્ર બે કરોડ રૂપિયામાં બે બિલ્ડર દ્વારા ખરીદાઈ હતી અને માત્ર ૧૧ મિનિટ પછી એ જ જમીન ટ્રસ્ટે ૧૮.૫૦ કરોડ રૂપિયા આપીને ખરીદી છે. માત્ર ૧૧ મિનિટમાં જમીનનો ભાવ નવ ગણો થઈ ગયો હોય એવો દુનિયાનો આ પહેલો કિસ્સો છે. પાંડેએ પોતાની વાતના સમર્થનમાં આ બંને સોદાને લગતા દસ્તાવેજો પણ મૂક્યા છે. આ બંને સોદામાં સાક્ષી તરીકે અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય છે. તેથી પાંડેએ ભાજપ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. પાંડેનું કહેવું છે કે, ભાજપ અને હિંદુવાદી સંગઠનોના નેતાઓએ ભગવાન રામના નામે દલ્લો ઘરભેગો કરી દીધો છે.

સૌથી મહત્વની વાત એ છે કે જમીન સોદામાં ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી હતા. ટ્રસ્ટ દ્વારા જે 2 કરોડની જમીન 18.5 કરોડમાં ખરીદવામાં આવી, તેનો સર્કલ રેટ 5 કરોડ 80 લાખ જ હતો, જ્યારે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું કે જમીન 18.5 કરોડમાં ખરીદવામાં આવી, તે માર્કેટ રેટથી ઘણી સસ્તી છે. મહેસૂલ વિભાગથી જોડાયેલા એક મોટા અધિકારીનું માનીએ તો કોઈ પણ જમીનને જો સરકાર લે છે તો શહેરી ક્ષેત્રમાં સર્કલ રેટથી બમણા અને ગ્રામીણ ક્ષેત્રમાં 4 ઘણાથી વધારે વળતર ના આપી શકાય, પરંતુ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યા નગર વિસ્તારમાં જે જમીન ખરીદાઈ તે સર્કલ રેટથી 3 ઘણા વધારે ભાવમાં લેવામાં આવી છે. શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર લાગેલા જમીન ગોટાળાના આરોપમાં નેતાઓ બાદ હવે દારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ નિવેદન આપી નારાજગી બતાવી છે.

પીઠાધીશ્વર જગતગુરુએ નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વરમાં પરમહંસી ગંગા આશ્રમમાં પ્રેસ કોન્ફ્રન્સ કરી તેઓએ RSS અને BJP પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચંપતરાય કોણ છે તે પહેલાં કોઈ જાણતું પણ નહોતું, પરંતુ તેઓને રામમંદિર ટ્રસ્ટમાં સર્વે સર્વા બનાવી દેવામાં આવ્યા છે. મંદિર બનાવવા માટે જે રકમ મળી તેમાંથી મોંઘા ભાવે જમીન ખરીદવામાં આવી રહી છે. વડા પ્રધાને તેમને તાત્કાલિક રામજન્મભૂમિ ટ્રસ્ટના સચિવપદેથી હટાવી દેવા જોઈએ. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, ડો. પ્રવીણ તોગડિયાએ રામ મંદિર ટ્રસ્ટ પર થયેલા કૌભાંડના આરોપને ખૂબ જ કમનસીબ ગણાવ્યા છે. તોગડિયાએ કહ્યું કે, આ આરોપ કોઈ ચંપત રાય પર નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલી રહેલા હિન્દુ આંદોલનની ઈમાનદારી પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભુ કરે છે. આક્ષેપો સામે સ્પષ્ટતામાં જે ખુલાસા આપવામાં આવી રહ્યા છે તેનાથી સહમત થવું મુશ્કેલ છે.

જો કે, બીજી તરફ ટ્રસ્ટે જમીન ખરીદીને લઈને ઉઠેલા આક્ષેપોને બકવાસ અને રાજકીય ગણાવીને સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શી હોવાનો દાવો કર્યો છે. ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું કહેવું છે કે, જમીનના માલિકો સાથે જમીનના ખરીદદારોએ વરસો પહેલાં એ વખતના ભાવ પ્રમાણે કરાર કર્યા હતા. આ વર્ષના માર્ચ મહિનામાં જમીનનો દસ્તાવેજ એ જ ભાવે થયો અને પછી હાલના બજાર ભાવે આ જમીનનો દસ્તાવેજ ટ્રસ્ટના નામે કરી દેવાયો. રાયની દલીલ ગળે ઉતરે તેવી નથી.

જમીનના દસ્તાવેજમાં જમીનની કિંમત જમીનનો સોદો ક્યારે થયેલો તેના આધારે લખાતી નથી. પણ દસ્તાવેજ થાય ત્યારે સરકારી નિયમ પ્રમાણે લાગુ પડતી જંત્રી પ્રમાણે થાય છે. આ જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ લાગુ પડે છે અને દસ્તાવેજમાં એ જ રકમનો ઉલ્લેખ થાય છે. હવે જે જમીનની કિંમત અત્યારે જંત્રી પ્રમાણે બે કરોડ રૂપિયા નક્કી થઈ હોય તેની કિંમત દસ મિનિટ પછી સાડા અઢાર કરોડ રૂપિયા કરી રીતે થઈ જાય? ચંપત રાયે આ સવાલનો જવાબ ટાળ્યો છે. ચંપત રાયે કેટલા સમય પહેલાં આ સોદો થયેલો તેની વિગતો પણ આપી નથી. તેના કારણે શંકા વધારે પ્રબળ બને છે. ત્રીજો મુદ્દો સરકારને થતા નુકસાનનો છે.

એક જ જમીનના દસ મિનિટના ગાળામાં બે અલગ અલગ રકમ પ્રમાણે દસ્તાવેજ થાય એ સંજોગોમાં સરકારને ચૂકવાયેલી સ્ટેમ્પ ડ્યુટીની રકમનો ફટકો પડ્યો છે. ટ્રસ્ટ બજાર ભાવે જમીન ખરીદાનો દાવો કરે છે, જ્યારે પહેલો દસ્તાવેજ બે કરોડ રૂપિયાનો થયો છે એ જોતાં ગેરરીતિ થયાની શંકા જાય છે. હવે મુખ્ય સવાલ એ છે કે, ટ્રસ્ટે આ બધી વિગતો પહેલા કેમ જાહેર ના કરી? આ બંને સોદા આ વરસના માર્ચ મહિનામાં એટલે કે ત્રણ મહિના પહેલાં થયા હોવાનું કહેવાય છે. ટ્રસ્ટે પારદર્શકતા બતાવીને એ વખતે જ આ સોદાની વિગતો જાહેર કરવી જોઈતી હતી. આ તો સમાજવાદી પાર્ટીના ધારાસભ્યે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો એ પછી ટ્રસ્ટવાળા ચોખવટો કરવા લાગ્યા છે. ચંપત રાયે આક્ષેપોને રાજકીય ગણાવીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો છે. જો કે રામ જન્મભૂમિ મંદિર માટેની જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સામે થયા છે ત્યારે સવાલ એ છે કે, વખતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને સંઘ એક છે? ચંપત રાયનું વલણ એવું જ ચિત્ર ઊભું કરી રહ્યું છે.

મોટી સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ. કેમ કે આ ટ્રસ્ટ સંઘનું પણ નથી. આ ટ્રસ્ટ ભારત સરકારે બનાવેલું ટ્રસ્ટ છે. તેને સંઘ કે બીજા કોઈ સંગઠન સાથે કોઈ લેવાદેવા નથી. જાહેર જીવનમાં પડેલા લોકોના વ્યવહાર અને વર્તન એવાં હોવાં જોઈએ કે, કોઈ આંગળી પણ ના ચીંધી શકે. કોઈ આંગળી ચીંધી તેનો અર્થ એ થાય કે, તમારા વ્યવહાર અને વર્તનમાં પારદર્શિતા નથી. મર્યાદા પુરૂષોત્તમ રામનું ચારિત્ર્ય અણિશુદ્ધ છે અને તેમણે જે ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યા તેના માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. રાવણના વધ પછી અયોધ્યા પાછા ફરેલા ભગવાન રામે એક ધોબીની વાત સાંભળીને સીતા માતાનો ત્યાગ કર્યો હતો. આમ કરીને ભગવાન રામે સ્પષ્ટ કરી દીધેલું કે, પ્રજાજનોમાંથી એક વ્યક્તિને પણ શંકા થાય એવું કશું શાસકે ના કરવું જોઈએ. આપણે વિચારવું જોઈએ કે, ભગવાન રામનું મંદિર બનાવવા નિકળેલા ચંપત રાય જેવા લોકો પોતે ભગવાન રામના આ સિદ્ધાંતમાં માનતા નથી.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

INDEPENDENTLY OWNED AND OPERATED

JAY PATEL
BROKER

647.241.3818
jaypatel1323@gmail.com

"Let Me Make Your Dream Home Into A Reality"

Residential, Commercial & Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924
295 Queen Street East, Brampton, On., L6W 3R1

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice
✓ Rat

✓ Cockroach
✓ Bedbug

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

✓ Animal Control
✓ Bird Control
✓ WASPS and
✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.
Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



પાલિતાણા, અંકલેશ્વર, મોરબીમાં એરસ્ટ્રીપ, શેત્રુંજય ડેમમાં વોટર એરોડ્રામનું આયોજન

અમદાવાદ

ગુજરાતમાં અંબાજી, દ્વારકા, પાલિતાણા સહિત કુલ ૬ સ્થળે નવી એરસ્ટ્રીપ બનાવવાના આયોજનને આખરી ઓપ અપાશે અને ટૂંક સમયમાં તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(ગુજસેઈલ) દ્વારા અંકલેશ્વર, રાજપીપળા, મોરબી, અંબાજી, દ્વારકા અને પાલિતાણામાં નવી એરસ્ટ્રીપ વિકસાવવામાં આવશે. પ્રવાસનને વધુ વેગ મળે તેવા ઉદ્દેશના ભાગરૂપે આ સ્થળની એરસ્ટ્રીપ માટે પસંદગી



કરવામાં આવી છે. આ પૈકી અંબાજી, દ્વારકા, ધાર્મિક રીતે મહાત્મ્ય ધરાવે છે. એરસ્ટ્રીપ વિકસાવ્યા બાદ 'ઉડાન' યોજના હેઠળ આ ૬ શહેરને વિવિધ ફ્લાઈટ સાથે સાંકળવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ૬ શહેરમાં ૬ એરસ્ટ્રીપ બનાવવાનું આયોજન છેલ્લા

પાંચ વર્ષથી કાગળ પર છે. પરંતુ હવે તેને અંતિમ ઓપ આપવાનું શરૂ થઈ ચૂક્યું હોવાનો દાવો કરાયો છે.

આ ઉપરાંત પ્રવાસનમાં વૃદ્ધિ થાય તેના ભાગરૂપે શેત્રુંજય ડેમમાં પણ વોટર એરોડ્રામ તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી શેત્રુંજય સુધી સી પ્લેનની બીજી સર્વિસનો પ્રારંભ થઈ શકે છે. હાલમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન સર્વિસ છે. ભવિષ્યમાં અમદાવાદથી દ્વારકા વચ્ચે સી પ્લેન સર્વિસ શરૂ કરવાની પણ વિચારણા થઈ રહી છે.

મુળ ચીખલીની નૈત્રી પટેલની યુએસ નેવી ફોર્સમાં નિમણૂક

નવસારી

મુળ ચીખલીના પાટીદાર પરિવારની નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂક, તેના વિશે જાણીને ગર્વ થશે. અમેરિકાના મિસિસિપી શહેરમાં રહેતા ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના પરિવારોની દીકરી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂક થતાં વાંઝણા સહિત તાલુકામાં ખુશી ફેલાઈ ગઈ છે. શિકાગોમાં નેવલબેઝ ટ્રેનિંગ કેમ્પસમાં 10 અઠવાડિયાની તાલીમ પુરી કરીને નૈત્રી પટેલે નેવીમાં સેઈલર પદે નિમણૂક મેળવી સમગ્ર તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.



ગામના પાટીદાર સમાજના નિરવ દુર્લભભાઈ પટેલ ઘણા વર્ષથી નોકરી ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયા હતા. તેમની દીકરી નૈત્રી પટેલે અમદાવાદમાં SSC સુધી અભ્યાસ કર્યા બાદ તેમનો પરિવાર 6 વર્ષ પૂર્વ અમેરિકા ગયો હતો. જ્યાં મિસિસિપી સ્ટેટમાં મોટેલના વ્યવસાય સાથે નિરવ પટેલ જોડાયા હતા. પોતાના માતા-પિતા, નાનાભાઈ સાથે રહેતી નૈત્રી પટેલે મિસિસિપી યુનિવર્સિટીમાં કોલેજ કક્ષાનો અભ્યાસ કર્યો છે.

ચીખલી તાલુકાના વાંઝણા

ગુજરાતમાં વાજબી ભાવની 1500 જેટલી દુકાનોને ખંભાતી તાળાં વાગી ગયાં

અમદાવાદ : ગુજરાતમાં હવે વ્યાજબી ભાવની દુકાનો ચલાવવી ય પોષાતી નથી. ઓછા કમિશન સહિત વિવિધ કારણોસર વ્યાજબી ભાવના સંચાલકો રાજીનામા ધરીને અન્ય વ્યવસાય તરફ વળ્યાં છે. ગુજરાતમાં કુલ મળીને 1455 વ્યાજબી ભાવની દુકાનોને ખંભાતી તાળાં વાગ્યાં છે. અમરેલી, વડોદરા, સુરત અને અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વ્યાજબી ભાવની દુકાનો સૌથી વધુ બંધ થઈ છે. ગુજરાતમાં એક સમયે વ્યાજબી ભાવની દુકાનોના પરવાના મેળવવા પડાપડી થતી હતી. એવો ય સમય હતો કે, ઘઉં સહિત અનાજ-કેરોસીનમાં ગેરરીતી આચરી સંચાલકો ગરીબોનો કોળિયો ઝુંટવી કાળાબજારિયા સાથે હાથ મિલાવી કમાણી કરતાં હતાં. જોકે, અત્ર પુરવઠા વિભાગે ઓનલાઈન સિસ્ટમ અમલી બનાવી છે જેના કારણે ગેરરીતો પર કાબૂ મેળવાયો છે.

રેમડેસિવિર ઈન્જેક્શન મામલે સી. આર પાટિલે કંઈ જ ગેરકાયદે નથી કર્યું

સુરત : રેમડેસિવિર ઈન્જેક્શન ગેરકાયદેસર રીતે મેળવવા, સંઘરાખોરી કરવા અને તેના વિતરણ મુદ્દે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ અને અન્ય સામેની જાહેરહિતની અરજીમાં સરકારે પાટીલના નામનો ઉલ્લેખ કર્યા વગર ક્લીન ચીટ આપી છે. મંગળવારે રાજ્ય સરકારે અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં પાટીલ તરફથી કંઈ જ ગેરકાયદે થયું નથી તેમ જણાવાયું હતું. બીજી તરફ, પરેશ ધાનાણીના વકીલે જવાબ રજૂ કરવા માટે બે સપ્તાહનો સમય માગ્યો હતો, જે માગને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ ઉપરાંત, હાઈકોર્ટે સી.આર. પાટીલને નિર્દેશ આપ્યો છે કે, 'એક સપ્તાહમાં જવાબ રજૂ કરો, હવે પછી સમય આપવામાં આવશે નહીં.'

રાજ્યમાં ૬૩૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીની અરજી: ગત વર્ષ કરતા ૩ ગણી વધારે

ગાંધીનગર : કોરોના વચ્ચે પણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં યુનિ.ઓમાં વિવિધ કોર્સમાં પ્રવેશ માટે આઈસીસીઆર હેઠળ મોટા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓની અરજી આવી છે. આ વર્ષે માત્ર ગુજરાત માટે જ સૌપ્રથમવાર ૬૩૦૦થી વધુ અરજીઓ આવી છે અને જે ગત વર્ષ કરતા ત્રણી વધારે છે. ૬૩૦૫ અરજીમાંથી ૨૨૦૪ વિદ્યાર્થીની અરજી ૧૫ જુન સુધી કન્ફર્મ થઈ છે. ભારતના વિવિધ રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે આઈસીસીઆરની સ્કોલરશિપ હેઠળ આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે અને સૌથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ અત્યાર સુધીમા કન્ફર્મ થયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગત વર્ષે કોરોના બાદ પણ મે-જુન દરમિયાન ૨ હજાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓની અરજી આવી હતી.

THANK YOU FRONTLINE WORKERS



MORTGAGE DILIGENT
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

5 Yrs Fixed @ 1.84%* High Ratio Only
5 Yrs Variable @ 1.15%* High Ratio Only
3 Yrs Variable @ 0.99%* (Special Promotion)



Rakesh Patel**
Vice President- Commercial.



Pranay Jani *



Nilesh Tailor *



Bala Shah*



Vijay Rana*



Rajesh Khurana, MBA
Principal Broker

Cell : 416-616-1300

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.* FSCO#10252,OAC,E&O.E * - Mortgage Agent, ** - Vice President

* Some conditions apply

આધુનિક જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે SMCએ મંજૂરી માંગી

સુરત

સુરતમાં ત્રીજી વેવના ખતરા સામે લડવા માટે પાલિકા તંત્રએ આગોતરૂ આયોજન શરૂ કર્યું છે. પહેલા અને બીજા વેવ કરતાં વાર્ધરસમાં બદલાવ આવે તેવી ભીતી છે. જેના કારણે પાલિકાએ બદલાયેલા વેરિયન્ટની માહિતી મેળવવા માટે અતિ આધુનિક જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવા આઈસીએમઆરને પત્ર લખીને મંજૂરી માંગી છે.

સુરતમાં કોરોનાની બીજી લહેરનું જોર ધીરુ પડ્યું અને કેસની સંખ્યા ૬૦થી નીચે આવી ગયાં છે પરંતુ જે રીતે સોશયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના લોકોની ભીડ ભેગી થઈ રહી છે તે જોતાં ત્રીજો વેવ આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. જેથી પાલિકાએ તૈયારીના ભાગ રૂપે બાળકો માટેના વેન્ટીલેટર, દવાઓ તથા બેડની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. જોકે, બીજા વેવ કરતાં ત્રીજા



વેવના વાર્ધરસમાં વેરીયન્ટમાં મોટો બદલાવ આવે અને ઘાતકી બની શકે તેવી શક્યતા હોવાથી પોલીટીવ કેસ પર ખાસ નજર રાખવાનું શરૂ કરાયું છે.

પાલિકાએ વેરીયન્ટમાં બદલાવ જાણવા જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટેનું આયોજન કર્યું છે. ટેસ્ટ મોંઘો છે પણ બદલાવ જાણીને તે મુજબ આયોજન કરી શકાય છે. જે આરટીપીસીઆર સેમ્પલ લે છે તેનું સતત જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવા આયોજન છે. આઈસીએમઆરને પત્ર લખીને જીઓમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે મંજૂરી માંગી છે.

85 વર્ષની માતાની જવાબદારી નિભાવવા પુત્રએ તૈયારી દર્શાવતા માતાએ કેસ પરત ખેંચ્યો

સુરત

સગરામપુરા વિસ્તારમાં રહેતા સેજલબેનના લગ્ન ગુલાબભાઈ સાથે થયા હતા. સંતાનો પ્રત્યેની તમામ જવાબદારી પુર્ણ કર્યા બાદ પતિ ગુલાબભાઈનું 1988માં નિધન થયું હતું. જે બાદ મિલકતના મુદ્દે માતા-પુત્ર વચ્ચે વૈચારિક ઘર્ષણ તથા તકરાર થતી હતી. પોતાની વૃધ્ધાવસ્થામાં સારસંભાળ તથા દેખરેખ રાખવામાં બેદરકારી દાખવનાર પુત્ર રાજેશભાઈ તથા પુત્ર વધુ વિરુદ્ધ સેજલબેને ભરણ પોષણ માટે ફેમીલી કોર્ટમાં ધા નાખી હતી. જેમાં પુત્ર રાજેશભાઈને માસિક રૂ.4500 ભરણ પોષણ ચુકવવા હુકમ થયો હતો. આ સાથે સમાધા માટે પણ પ્રયાસ થતા પુત્ર રાજેશભાઈએ ભૂતકાળ ભુલીને વૃધ્ધ માતાને પોતાની સાથે રહેવા લઈ જઈને તમામ ફરજો જવાબદારી અદા કરવાની તૈયારી દાખવી હતી. જ્યારે વૃધ્ધ માતાએ પણ પોતાના પુત્ર વિરુદ્ધ કરેલો કેસ પાછો ખેંચી લીધો હતો.

મરોલીના જૈન યુવકના અંગદાનથી દેશના 6 દર્દીઓને મળ્યું નવજીવન

સુરત

મૂળ મહારાષ્ટ્રમાં માધવનગરના અને છેલ્લાં ઘણાં વર્ષોથી મરોલી રહેતા વિશા ઓસવાળ જૈન સમાજના 45 વર્ષીય દિનેશભાઈ મોહન છાજેડને ગત તા. 11 જૂનની રાત્રે બ્લડ પ્રેશર વધી જતા શરીરમાં જમણી બાજુ લકવાની અસર થઈ હતી. તેમને તાત્કાલિક નવસારીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેન કરાવતા બ્રેઈન સ્ટ્રોકને કારણે મગજમાં ડાબી બાજુ લોહી ફરતું બંધ થઈ ગયું હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબોએ ગત

સોમવારે દિનેશભાઈને બ્રેઈનનેડેડ જાહેર કર્યા હતા. જે બાદ પરિવારે યુવકના હૃદય, કિડની, લિવર અને ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. સંયુક્ત પરિવારમાં ઉછરેલા દિનેશભાઈ છાજેડના પરિવારમાં તેમના વયસ્ક પિતા ઉપરાંત તેમની પત્ની અને 13 વર્ષનો એક પુત્ર છે. - ગ્રીન કોરિડોર બનાવી અંગોને મુંબઈ-અમદાવાદ મોકલાયા હતા. સુરતથી મુંબઈનું 300 કિમીનું અંતર 92 મિનિટમાં કાપી હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના મહિલામાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના 43 વર્ષીય વ્યક્તિ કરવામાં આવ્યું હતું.

સુરતમાં હૃદયદાનની 33મી ઘટના બની

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ તૈંત્રીસમી ઘટના છે. જેમાંથી 22 હૃદય મુંબઈ, ૫ હૃદય અમદાવાદ, 4 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઈન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ચક્ષુઓનું દાન સુરત નવી સિવિલ હોસ્પિટલે સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અંગદાન કરવામાં સુરત અને દક્ષિણ ગુજરાત અત્યારસુધી સૌથી આગળ નોંધાયું છે.

વ્યારાના બિલ્ડર નિશિષ શાહની હત્યા માટે સાળાએ આપી સોપારી

વ્યારા

14 મેના રોજ વ્યારાના બિલ્ડર નિશિષ શાહની હત્યા થઈ હતી. આ કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. બિલ્ડર નિશિષ શાહની સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે અને આ હત્યા બિલ્ડરના સાળાએ જ કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મુખ્ય સૂત્રધાર તરીકે વિજયપટેલનું નામ પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

પોલીસ તપાસમાં સાળા એ જ બનેલીની હત્યાની સોપારી આપી હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. મુખ્ય સૂત્રધાર તરીકે વિજય પટેલનું નામ પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. વિજય પટેલ બિલ્ડર અને પેટ્રોલ પમ્પના ધંધા સાથે સંકળાયેલ હોઈ જિલ્લા સહિત વ્યારા

નગરમાં ચક્રચાર મચી ગઈ છે. આ મામલે વ્યારા પોલીસે CRPCની કલમ 70 મુજબ કોર્ટમાંથી વિજય પટેલનું કાયમી ધરપકડ વોરંટ મેળવ્યું છે. જણાવી દઈએ કે, હત્યાના થોડાક સમય પહેલા વિજય પટેલ અને નિશિષ શાહ વચ્ચે જાહેરમાં ઝગડો પણ થયો હતો. ઉલ્લેખનિય છે કે, કારમાં આવેલા ચાર અજાણ્યા હત્યારાઓએ નિશિષ શાહની મોપેડને ટક્કર મારી પાડી દીધા હતા, ત્યાર બાદ આ લોકો બિલ્ડર નિશિષ શાહ પાછળ દોડ્યા હતા અને આરોપીઓએ શનિદેવના મંદિર નજીક રસ્તા પર નિશિષને તલવાર અને ચપુના ધા મારી કાસળ કાઢી નાખ્યું હતું. નિશિષ શાહની હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી કારમાં નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના કેટલાક સ્થાનિકોએ પણ જોઈ હતી અને CCTV કેમરામાં પણ કેદ થઈ હતી.

"Savings For YOU. Protection for Your Loved Ones"

: Offered services :

1. Life Insurance
2. Mortgage Insurance
3. Critical Illness Insurance
4. Visitors Medical Insurance
5. Tax Return Filing
6. Super Visa Travel Insurance



Shailesh Patel

CALL TODAY
Cell : 416 837 9155
Email : shailesp@gmail.com

We represent many insurance companies, we can shop around for best rates.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

| | | |
|-------------------------|---------------------------|------------------------------|
| 1 Spray Services | 2 Fogging Services | 3 Sanitation Services |
|-------------------------|---------------------------|------------------------------|

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

First Time Customer gets **10% Off** on your first home service
*Mention this offer while booking

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

| | | | |
|--|--|---|--|
|  <p>Registration # 869127209 Publication Mail Agreement / Email : info@swadesh.news</p> | <p>Return Undeliverable Canadian Address To :</p> <p>Shree Balaji Inc. MAILING ADDRESS 23 Lyric Road, Brampton ON L6S 0B4. 416-996-7755</p> | <p>Editor & Publisher : Manoj Gandhi Director : Nilesh Tailor Sub Editor : Chhaya Gandhi Montreal Bureau : Vijay Patel (514-826-7442)</p> | <p>Designed By Sabir Daroga Mevada Piyush Firoz Shaikh</p> |
| | <p>Registered Address 713, Markham Road, Scarborough M1H 2A8.</p> | <p>GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)</p> | <p>WWW.SWADESH.NEWS</p> |



મજબૂત મહિલા કદી હાર માનતી નથી: પૂજા હેગડે

દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહી ચાહકો સાથે વાતચીત કરતી રહે છે. તે પોતાની આવની છ ફિલ્મોને કારણે પણ ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં પૂજાએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે મહિલાઓને મજબૂત રહેવા સંદેશો આપ્યો હતો. પંદર સેકન્ડના આ વિડીયોમાં તેણે એ વાત જણાવી છે કે મજબૂત મહિલા કદી હાર માનતી નથી. પૂજા હાલમાં અનેક બિગ બજેટ ફિલ્મો કરી રહી છે.



સ્વદેશ

09

Web : www.swadesh.news | E-mail : info@swadesh.news

FRIDAY, 18 JUNE, 2021

કોરોનાની દવાઓને લઈ બોમ્બે HCએ સોનૂ સૂદ સામે તપાસના આદેશ આપ્યા



સોનૂ સૂદ કોરોના મહામારીની વચ્ચે તમામ લોકો માટે એક ફરિશ્તો સાબિત થયો છે. જ્યાં પહેલી લહેર દરમિયાન તેણે પ્રવાસી મજૂરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યા તો બીજી લહેરમાં તેણે જરૂરિયાતમંદો માટે ઓક્સિજન સિલિન્ડર, ICU બેડ્સ, ઈન્જેક્શન જેવી વસ્તુઓની વ્યવસ્થા કરી. હવે બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ કર્યો છે કે તે સોનૂ સૂદ અને કોંગ્રેસ ધારાસભ્ય જુશાન સિદ્દીશની તપાસ કરો કે કોરોનાની દવાઓ બંનેની પાસે કેવી રીતે પહોંચી. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે, સેલિબ્રિટી પોતાને મસીહા તરીકે રજૂ કરી રહ્યા હતા જ્યારે તેઓએ એ વાતની પૃષ્ઠિ ન કરી કે શું દવાઓ નક્કી છે કે પછી શું તેને તેમના સુધી ગેરકાયદે રીતે તો પહોંચાડવામાં આવી રહી નથી ને. કોર્ટે કહ્યું કે આ બંને દ્વારા ઉપલબ્ધ કરાયેલ દવાઓના મામલામાં પુછપરછ કરવામાં આવે.



થિલરમાં ખુબ ક્ષમતા હોય છે

પંદર વર્ષની ઉંમરે બોલીવૂડમાં વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ચે ચાંદ સા રોશન ચહેરા થકી અભિનય કારકિર્દી શરૂ કરનાર તમન્નાએ આ ફિલ્મ પછી દક્ષિણમાં ડગલા માંડી દીધા હતાં. ત્યાં તેને એટલી સફળતા મળી કે પછી પાછુ વળીને જોયું નથી. દક્ષિણની તેની ખુબ સફળતા તેને ફરીથી બોલીવૂડમાં પણ લાવી છે. હવે તે અહિ પણ એક પછી એક મોટી ફિલ્મો કરતી રહે છે. બાહુબલી તેની સૌથી સફળ ફિલ્મોમાં એક છે. તેની એક પછી એક નવ હિન્દી અને સાઉથની ફિલ્મો કતારમાં છે. તમન્ના ભાટિયા દરેક જોનરની ફિલ્મો કરી ચુકી છે. તેણે કહ્યું હતું કે થિલર ફિલ્મમાં એટલી ક્ષમતા હોય છે કે દર્શકો એકસાથે જ આખી સિરીઝ જોઈ શકે છે. તમન્ના કાદમ-થિલર 'ઇલેવન્ટ અવર'માં અન 'નવેમ્બર સ્ટોરી' નામની સિરીઝમાં જોવા મળી છે. થિલર વિશે તમન્નાએ કહ્યું હતું કે થિલરને જો સારી રીતે બનાવવામાં આવે તો એમાં એટલી ક્ષમતા હોય છે કે એને તમે એક જ બેઠકમાં જોઈ શકો છો. દરેક નિર્માતાની એવી ઇચ્છા હોય છે કે તેમની સિરીઝ બધા જુએ.



અભિનેત્રી ઉર્વશી ચૈતેલાએ લીધું મડ બાય

ઉર્વશી ચૈતેલા પોતાની આ તસવીર શેર કરીને ચર્ચામાં આવી છે. તેણે મડ બાય લેટી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે લેપ લગાવેલું જોવા મળે છે. ઉર્વશીની આ તસવીર વાયરલ થઈ રહી છે. સાથે જ અત્યાર સુધી લાખો લાઇક્સ પણ આવી ચૂક્યાં છે. એક યુઝરે લખ્યું કે, અનિલ કપૂરની નાયક ફિલ્મ જોઈ લીધી? આમ, કમેન્ટ બોક્સમાં ઘણી રસપ્રદ કમેન્ટ્સ પણ આવી રહી છે.

PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ

Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time

Tico # 50015262
tico.ca
Travel Industry Council of Ontario

GRAND CENTRAL MIMICO
(South Tower)

Guaranteed Access to this prestigious project.

Located at Royal York Rd & Evans Ave in Etobicoke! Grand Central Mimico will feature direct access to the Mimico GO Station,

Starting from \$500's

Century 21
Nadir Shah MBA
Sales Representative

416.625.3580
nadir.shah@sympatico.ca

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Brooker
4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6 T: 416.291.0929 (24/7)
F: 416.291.0984

Not intended to solicit buyers or sellers already under a contract



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

નવા આઈટી કાયદાનું પાલન કરવા સમંત નહીં થતાં ભારતમાં ટ્વિટરનું લીગલ પ્રોટેક્શન ખતમ

શક્તિશાળી ટ્વિટર પર ભારતમાં લટકતી તલવાર

ભારતમાં સોશિયલ મીડિયા પર લગભગ કસવાના ભાગરુપે મોટી સરકારે હાથ ધરેલી ક્વાયતમાં ટ્વિટર સામે કડક પગલા ભરાય તેવા સંજોગો ઉભા થયા છે. નવા આઈટી એક્ટ અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકારે નવા નિયમ બનાવ્યા છે. જેને લાગુ કરવા માટે મહિના સુધીનો સમય સોશિયલ મીડિયાની કંપનીઓને આપવામાં આવ્યો હતો. ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓએ છેલ્લે છેલ્લે મોટી સરકારે ઘડેલા નવા નિયમો લાગુ કરવા અંગે સંમતિ દર્શાવી હતી. જ્યારે ટ્વિટર તો આજે પણ ટસથીમસ નહીં થતાં આગામી દિવસોમાં સરકાર તેની સામે નક્કર પગલા લઈ શકે છે. હાલના સંજોગોમાં ટ્વિટરને ભારતમાં મળતું લીગલ પ્રોટેક્શન ખતમ થઈ ગયું છે. સરકારે ગત ૨૫ મેએ નવા નિયમો લાગુ કર્યા હતા. પરંતુ ટ્વિટરે હજુ સુધી આ નિયમોનું પાલન કર્યું નથી. ટ્વિટરને મળેલું કાયદાનું કવચ દૂર થતા તે સંકટમાં આવી ગયું છે. હવે તે ભારતના કાયદા હેઠળ આવી ગયું છે અને તેને કોઈ પણ વાંધાજનક માહિતી માટે જવાબદાર ઠરાવી શકાય છે. ટ્વિટરનું લીગલ પ્રોટેક્શન દૂર થતા જ ગાઝિયાબાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ ભ્રામક કન્ટ્રેન્ટ દૂર નહીં કરવા અંગે એફઆઈઆર પણ નોંધાઈ ચુકી છે.

આઈટી ખાતાએ 2021ના ફેબ્રુઆરી મહિનામાં નવા આઈટી એક્ટની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીઓ માટે અનેક નવા નિયમ અમલી કરવા તૈયારી કરાઈ હતી. જ્યારે સોશિયલ મીડિયાની સંચાલક કંપનીઓને સરકારે ઘડેલા નવા નિયમના પાલન માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયસીમા મે મહિનામાં પૂરી થઈ ગઈ અને ફેસબુક, ગૂગલ તેમજ વોટ્સએપએ નવા નિયમો માનવા સંમતિ દર્શાવી છે. જો કે, ટ્વિટરે પહેલાથી જ ભારત સરકારના આ નિયમો સામે વાંધો ઉઠાવેલો હતો. ટ્વિટરની આ મુદ્દે સતત દલીલ હતી કે, અભિવ્યક્તિની આઝાદીને કોઈ પણ સંજોગોમાં ખતરામાં મુકી શકાય નહીં. સરકારના નવા નિયમો ભારતમાં લોકતાંત્રિક પ્રણાલી માટે જોખમી પુરવાર થઈ શકે છે. ટ્વિટરનું માનવું તો એવું પણ છે કે, આ જ પ્રકારે નિયમો બનશે તો જે તે દેશની સરકાર કે શાસક વિરુદ્ધ આ પ્લેટફોર્મ પર રજૂ થતી સત્ય હકીકતો ઉજાગર થશે નહીં. વળી, જે તે દેશમાં અધિકારી સરકાર કે શાસકોની વિરુદ્ધના સંદેશ મુદ્દે વાંધો ઉઠાવશે અને તેવા સંદેશો સાચા હોય તો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવા પડશે. ટ્વિટરની આ દલીલમાં કેટલાક લોકોને તર્ક



દેખાય રહ્યો છે. નવા નિયમો અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીઓ પર આવતી સામગ્રી માટે કંપનીને જવાબદાર ઠરાવવાની જોગવાઈ છે અને એ અંગેની ફરિયાદો ઉકેલવા માટે એક અધિકારી નિમણૂક કરવી ફરજિયાત છે. આ અધિકારીઓએ ફરિયાદ મળ્યા અંગે ૨૪ કલાકમાં જાણ કરવાની રહેશે અને મહત્તમ ૧૫ દિવસોમાં એના વિશે નિર્ણય લેવો પડશે. જો કોઈ અધિકૃત સંસ્થા અથવા અધિકારી, કહો કે સરકાર, કોઈ સામગ્રી હટાવવાનો આદેશ આપશે તો એને ૩૬ કલાકની અંદર દૂર કરવી પડશે. આ ઉપરાંત વધારાની કાયદાકીય કાર્યવાહી માટે તપાસ સંસ્થાઓને ૭૨ કલાકમાં સોશિયલ મીડિયા એટલે કે પ્લેટફોર્મ ધરાવતી કંપનીઓએ મદદ કરવાની રહેશે. આટલું ઓછું હોય તેમ સોશિયલ મીડિયા કંપનીઓ માટે

પ્રાસંગિક
ધવલ શુક્લ

સોશિયલ મીડિયા કંપનીઓને નવા નિયમના પાલન માટે ત્રણ મહિનાનો સમય અપાયો અને ફેસબુક, ગૂગલ તેમજ વોટ્સએપએ સંમતિ દર્શાવી છે પરંતુ ટ્વિટર હજી પણ ટસથીમસ થયું નથી

માસિક રિપોર્ટ જાહેર કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કંપનીઓએ બતાવવું પડશે કે, તેમને કેટલી ફરિયાદો મળી અને એ ફરિયાદો અંગે તેમણે કેટલા સમયમાં કેટલી કાર્યવાહી કરી. કંપનીઓ જાતે કોઈ વાંધાજનક માહિતી દૂર કરી કે નહીં એ અંગે પણ સ્પષ્ટતા કરવી પડશે.

જો કંપની નિયમોનું પાલન નહીં કરે તો કથિત

માહિતી માટે તેમને જવાબદાર ઠરાવવામાં આવશે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હવે ભારત સરકારની દલીલ એવી છે કે, આ મુદ્દે દેશની શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા સાથે પણ સંકળાયેલો છે. એટલે નવા નિયમો મુજબ દરેક કંપનીએ કામ કરવું પડશે. આ જ ટ્વિટરે થોડા મહિના પહેલાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પછાત કરી દીધું હતું. એટલે ટ્વિટર એટલું ચોક્કસ માને છે કે, તે દુનિયાના કોઈપણ દેશના સત્તાધીશોના તમામ આદેશો માનવા તૈયાર નથી. અથવા તો તે શાસકો જે કહે તે પ્રમાણે તે માનવા પણ તૈયાર નથી. બીજી તરફ નકરી વાસ્તવિકતા એવી છે કે, છેલ્લાં ઘણાં સમયથી સોશિયલ મીડિયાના જુદાં જુદાં પ્લેટફોર્મ પર દરેક પ્રકારની સામગ્રી બેરોકટોક મુકાઈ રહી છે. આ માટે યુઝર્સ પોતે પણ

કોઈ ચોક્કસાઈ કે સાવચેતી દાખવતા નથી. તેથી સોશિયલ મીડિયા વિવિધ પ્રકારે નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યાં છે. ભારત જ નહીં દુનિયાના અનેક દેશોએ આ માટે સજાગ થવાની આવશ્યકતા છે. આ સાથે જ યુઝર્સ કોઈપણ માહિતી કે ફોટો અથવા તો વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરે તે જોખમી હોય તો તેના પર નિયંત્રણ હોવું જરૂરી છે.

સોશિયલ મીડિયા જ અનસોશિયલ બની ચૂક્યાં છે. રોજ દિવસ ઊગેને આપણા સ્માર્ટફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાં વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવનવા મેસેજની વણઝાર ચાલુ થઈ જાય છે. આમાંના મોટાભાગના મેસેજ ફોરવર્ડ હોય છે. આપણે પણ એ મેસેજની સત્યતા પારખ્યા વગર તેને આગળ ફોરવર્ડ કરી દઈએ છીએ. લોકોને જોડવા માટે સર્જાયેલું સોશિયલ મીડિયા આજકાલ સમાજને તોડવાનું કામ કરી રહ્યું છે. સોશિયલ મીડિયાના દુરુપયોગથી સરકારથી લઈને રાજકીય પક્ષો, સંસ્થાઓ, સેલિબ્રિટીઓ અને સામાન્ય જનતા પણ પરેશાન છે. જો કે, અત્યાર સુધી આ જ રાજકીય પક્ષો, સેલિબ્રિટીઓ તથા કથિત બુદ્ધિજીવીઓએ આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાંધ્યો છે તે પણ નકરી વાસ્તવિકતા છે.

એક સમયે લોકોને એકબીજા સાથે જોડવાના માધ્યમ તરીકે વિકસેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે માહિતીના સ્થાને જૂઠાણાં, અર્ધસત્ય, ભ્રમ, અફવાઓ, ચારિત્ર્યહનન અને દ્વેષ ફેલાવવાના માધ્યમ બની રહ્યાં છે. આધુનિક ટેકનોલોજીના આ જમાનામાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટ ફોન અને સાવ સસ્તા દરે મળી રહેલા ડેટા પેકેજિસના કારણે ઇન્ટરનેટ સુધીની પહોંચ સાવ સરળ બની ચૂકી છે, જેના પરિણામે આજના દોરમાં સોશિયલ મીડિયા એક મોટી તાકાત બની ગયું છે. સોશિયલ મીડિયાના આ દોરમાં એક બાબત તો સ્પષ્ટ છે કે, સામાન્ય લોકોની માનસિકતાને અસર કરવામાં સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા ટોળાશાહીને વિકસિત કરવાનું કામ કરી રહ્યાં છે જે સમાજ અને દેશ માટે આજે નહીં તો કાલે ખતરનાક સાબિત થશે. ભારત સરકારે સોશિયલ મીડિયા અંગે અપનાવેલા આ વલણના આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે પડ્યા પડશે તે પણ ચોક્કસ છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ભારત એક વિશાળ બજાર છે. અહીંયા કામ કરતી સોશિયલ મીડિયા કંપનીઓએ વધારે સંવેદનશીલ રહેવાની જરૂર છે. કારણ કે, ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. એક જાણકારી અનુસાર વર્ષ ૨૦૨૦માં દર સેકન્ડે આશરે ૬ હજાર ટ્વીટ કરવામાં આવ્યાં હતા. એ જોતાં દર મિનિટે સાડા ત્રણ લાખ અને એક દિવસમાં આશરે ૫૦ કરોડ જેટલા ટ્વીટ થયાં. હવે જો આટલા શક્તિશાળી પ્લેટફોર્મ ઉપર ભારતવિરોધી પ્રચાર થવા લાગે તો તે કેટલો જોખમી નીવડે ? તેની તો કલ્પના જ કરવી પડે તેમ છે.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES



CANADA IMMIGRATION

**GOOD NEWS FOR RECENTLY
GRADUATED STUDENTS
INSIDE CANADA**

**STUDENTS UNDER POST GRADUATION WORK
PERMIT WITH IELTS 5 BAND CAN QUALIFIED
TO APPLY FOR PERMANENT RESIDENCY
RIGHT AWAY !!**

Effective May 6, 2021, Immigration, Refugees and Citizenship Canada (IRCC) will begin accepting applications under the following 3 streams:

20,000

applications
for temporary
workers in
health care

30,000

applications for
temporary
workers in other
selected essential
occupations

40,000

applications for
international
students who
graduated from a
Canadian
institution

**FIRST COME FIRST
SERVE BASIS !!**

CONTACT US IMMEDIATELY

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE
/ PR 90 DAYS INSURANCE**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS
WORLD MALL, BRAMPTON, ONT

**416-745-2466
905-230-7855**

2/A WAGHESHWARI SOC,
VADODARA GUJARAT INDIA

**91-9428973911
91-9512157817**

Email.: info@siis.ca

Website.: www.siis.ca



AMI MEHTA
IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION
TO CANADA REQUIRES
3 CR NET WORTH/
1.5 CR INVESTMENT/
BUSINESS OWNERSHIP/
MANAGEMENT EXP**

**REJECTED
CASES WELCOME**

**ONLINE IELTS
SPOKEN ENGLISH
CLASSES ON ZOOM**

આણંદમાં પત્નીના વિરહમાં ઝુરતા પતિએ 2 દીકરીની હત્યા કરી પોતે ગળે ટુંપો દીધો

આણંદ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દુધવાડા ગામના ચિરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિના લગ્ન આણંદની લતા નામની યુવતી સાથે થયા હતા. અને છેલ્લા ત્રણ વર્ષથી ચિરંજીવી આણંદ શહેરમાં બોરસદ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસ પાછળ મેલડીમાતાના ફળિયામાં પોતાની બે દીકરીઓ અને પત્ની સાથે રહેતો હતો. ચિરંજીવીની પત્ની લતાબેન છ માસ પૂર્વે પુત્રને જન્મ આપી મૃત્યુ પામી હતી.

પત્નીના અવસાન બાદ ચિરંજીવીના ત્રણ

બાળકોને તેઓની સાસુ સુશીલાબેન ઉછેરતા હતા. પરંતુ ચિરંજીવીને પોતાની મૃત્યુ પામેલી પત્નીની બહુ યાદ આવતી હતી. પત્નીનો વિરહ અસહ્ય બનતા ચિરંજીવીએ આત્મહત્યાનો પ્લાન બતાવ્યો હતો. અને તેણે નવું દોરડું ખરીદી ઘરમાં લાવીને મૂક્યું હતું. અને પોતાના મૃત્યુ બાદ પોતાની બંને દીકરીઓ અનાથ ના બને તે માટે ગત રાત્રિના સુમારે ચિરંજીવીએ ઘરમાં સુઈ રહેલી પોતાની બંને દીકરીઓને કોઈ ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પોતે પણ ઘરના મોભ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા

કરી હતી. મંગળવારે દૂધવાળો દૂધ આપવા આવતા દરવાજો નહીં ખોલતા આસપાસના લોકોએ દરવાજો ખોલી જોતા ચિરંજીવીનો મૃતદેહ દોરડા સાથે લટકતો હતો અને બંને દીકરીઓ મૃત હાલતમાં પથારીમાં પડી હતી, ઘટનાની જાણકારી મળતા આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચિરંજીવીનો છ માસનો પુત્ર તેની નાની પાસે સુઈ રહ્યો હોઈ આ માસુમ દીકરાએ માતાનાં મૃત્યુ બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

ક્લાસીફાઈડ / Classified

MOTEL HELP WANTED

Need one person for motel work located in north of Ontario 2.5 hr. from Toronto. Fully furnished accommodation will be provided, family can stay together. Work includes of office work, room making, general work and cleaning. If two people willing to work together one can get a work in our restaurant (separate). Interested can send resume on below E-Mail. jobformotel@gmail.com

ફેન્કલિન ટેમ્પલ્ટન ફંડના મેનેજમેન્ટને રૂપિયા 15 કરોડનો દંડ કરાયો

અમદાવાદ

ફેન્કલિન ટેમ્પલ્ટનના બંધ કરી દેવા પડેલા છ મ્યુચ્યુઅલ ફંડના કરવામાં આવેલા ઓરિટમાં ઘણી બધી અનિયમિતતાઓ બહાર આવી છે. આ અનિયમિતતા આચરવા બદલ ફંડને મેનેજ કરનારા અધિકારીઓને કુલ મળીને રૂ. 15 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. જોકે સેબી દ્વારા કરવામાં આવેલા દંડ સાથે ફેન્કલિન ટેમ્પલ્ટનનું મેનેજમેન્ટ સહમત નથી.

ફેન્કલિન ટેમ્પલ્ટન ટ્રસ્ટી સર્વિસિસને રૂ. 3 કરોડનો અને સી.ઈ.ઓ. સંજય સપ્રે તથા સીઆઈઓ સંતોષ કામતને રૂ. 2-2 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. ફેન્કલિન ટેમ્પલ્ટનની છ સ્કીમ સાથે સંકળાયેલા અન્ય સાત અધિકારીઓને દોઢ દોઢ કરોડ રૂપિયાનો કરવામાં આવેલા દંડની રકમ સહિત કુલ મળીને 15 કરોડની પેનલ્ટી કરવામાં આવી છે. ફેન્કલિન ટેમ્પલ્ટનના છ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોના કુલ રૂ. 26000 કરોડ ફસાયા હતા. તેમાંથી અત્યાર સુધીમાં 15000થી 16000 કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે. સેબીએ રૂ. દોઢ દોઢ કરોડનો દંડ કર્યો છે તેવા અધિકારીઓમાં કુણાલ અગ્રવાલ, સુમિત ગુપ્તા, પલ્લભ રોય, સચિન પડવાલ દેસાઈ અને ઉમેશ શર્માનો સમાવેશ થાય છે.

કપડવંજમાં ગરમીથી બચવા તળાવમાં નહાવા પડેલા ત્રણ બાળકના મોત

કપડવંજ : કપડવંજ તાલુકાના અંતિસાર ગામે એક સાથે ત્રણ ભૂલકાં તળાવમાં ડૂબી જતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બુધવારે ગામનાં ત્રણ બાળકો પણ તળાવ પાસે બકરી ચરાવવા ગયા હતા. જે બાદ તળાવમાં કોઈ ડૂબી ગયું હોવાની આશંકાથી અમુક યુવાનો તળાવ પાસે ધસી આવ્યા હતા. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ત્રણેય બાળકો તળાવમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તાત્કાલિક તેમને કાઢીને કપડવંજ પાસે એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. જીવ ગુમાવનાર બાળકોમાં અજીત જેસિંગભાઈ પરમાર, રાહુલ રણજીતભાઈ પરમાર અને સમીર રમણભાઈ રાવળનો સમાવેશ થાય છે.

હનીટ્રેપમાં જમીન મળતા જ મહિલાએ કલ્હું લાલજી સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં છું

બનાસકાંઠા

બનાસકાંઠાના ભાભર APMCના પૂર્વ ચેરમેન હનીટ્રેપ મામલો ટોક ઓફ ધ ટાઉન રહ્યો છે. જમીન પર છૂટકા બાદ કિષ્નાબેન માંડવીયાએ ભાભરમાં ઉપવાસ પર બેસવાનું નિવેદન આપ્યું હતું અને તેમણે તેવું પણ કયું હતું. કિષ્નાબેન આજે ભાભર માર્કેટયાર્ડના હનુમાન મંદિરમાં ઉપવાસ ઉપર બેસતા ભાભર પોલીસે તેઓની ધરપકડ કરી હતી.

ઉપવાસ ઉપર બેઠેલ કિષ્નાબેને ભાભર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને વર્તમાન ચેરમેનના પતિ લાલજીભાઈ પટેલ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. કિષ્નાબેન માંડવીયાએ

જણાવ્યું હતું કે, લાલજીભાઈ પટેલ સાથે હું 3 વર્ષથી લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. છતા ભાભર પોલીસ મારી ફરિયાદ લેતી નથી. મને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ઉપવાસ ઉપર બેસીશ.

મૂળ ગોધરા અને હાલ મેમનગર અમદાવાદ રહેતા કિષ્નાબેન માંડવીયા વિરૂદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં લાલજી ભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, કિષ્નાબેન સારા સંબંધો કેળવી તેમની પાસે અવારનવાર પૈસાની માગણી કરતી હતી. જોકે મદદ કરવાની ભાવનાથી અલગ-અલગ રીતે કુલ રૂ.31.34 લાખ રોકડા અને જરૂરી વસ્તુઓ અને સોનાની ચેન આપી હતી.

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના પહેલા પ્રકરણ (સુરાહ અલ ફાતિહા) અને તેનો પદ્યમય ભાવાનુવાદ

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં 114 પ્રકરણો છે. તેના પહેલા પ્રકરણનું નામ “અલ ફાતિહા” છે, જેનો ગુજરાતીમાં અર્થ શરૂઆત, ઉદ્ધતુ, આરંભવિધિ કે આરંભ થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આ નામ પ્રસ્તાવનાનું સમાનાર્થી છે.

પ્રકરણ એટલે અરબી ભાષામાં “સુરાહ” અને એ પ્રમાણે આ પહેલા પ્રકરણને “સુરાહ અલ ફાતિહા” કહેવામાં આવે છે. આ “સુરાહ અલ ફાતિહા” દરરોજની બંદગી (નમાઝ), જે પુરા દિવસમાં પાંચ વાર પઢવામાં આવે છે, તેમાં તેનું પઠન ફરજિયાત છે. આ રીતે દરરોજની નમાઝમાં “સુરાહ અલ ફાતિહા” દિવસમાં ઓછામાં ઓછી ૩૬ વાર અને વધારેમાં વધારે ૪૮ વાર પઢવામાં આવે છે.

આ પહેલા પ્રકરણ “સુરાહ અલ ફાતિહા”માં સાત શ્લોકો (આયતો) છે. પહેલા ત્રણ શ્લોકો (આયતો) સૃષ્ટિના પાલનહાર અલ્લાહની પ્રશંસા તથા ઓળખ બતાવે છે. અને છેલ્લા ચાર શ્લોકો (આયતો) પ્રાર્થના, યાચના, યાચિકા (દુવા) સમાન છે.

આ પહેલા પ્રકરણનો તથા કુરાન મજીદના બીજા બધા પ્રકરણો (સુરાહો) નો આરંભ પાલનહાર અલ્લાહના નામની સાથે થાય છે. આરંભ આ વાક્યથી થાય છે, જે અરબી ભાષામાં



મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના બોધવચનો પર આધારિત

છે: “બીસ્મિલ્લાહીર રહમાનીર રહીમ” જેનો અર્થ થાય છે: “આરંભ પાલનહાર અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.”

પહેલા પ્રકરણ જેના સાત શ્લોકો (આયતો) છે, તે પ્રકરણ (સુરાહ) “આરંભ” (સુરાહ અલ ફાતિહા)નું ગુજરાતી ભાષાંતર આ પ્રમાણે છે:

આરંભ પાલનહાર અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. (૧) સમસ્ત પ્રશંસા અલ્લાહ માટે જ

છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. (૨) તે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. (૩) તે ન્યાય તથા બદલાના દિવસ(કયામત)નો માલિક છે.

ઈસ્લામની આરસી
કાસિમ અબ્બાસ

(૪) (એ પાલનહાર), અમે તમારી જ સ્તુતિ (બંદગી) કરીએ છીએ, અને તમારી જ સહાય ઈચ્છીએ છીએ.

(૫) અમોને સીધા માર્ગે ચલાવજો. (૬) તે લોકોના માર્ગે, જેમના પર તમે કૃપાવંત થયા. (૭) તે લોકોના માર્ગે નહિ, જેઓ પર તમોએ પ્રકોપ કર્યો, અને તે લોકોના માર્ગે પણ નહિ, જેઓ અવળા માર્ગે ભટકી ગયા.

ભારતમાં એક સમયના “ભુદાન યજ્ઞવળ”ના પ્રણેતા શ્રી વિનોબા ભાવે સર્વધર્મ સમભાવ ના પણ સાચા પ્રણેતા હતા. તેમણે ઈસ્લામ ધર્મના પવિત્ર

ધર્મશાસ્ત્ર કુરાન મજીદનું ગુજરાતીમાં “કુરાન-સાર” નામક સંકલન કરાવ્યું હતું. તે માટે તેમણે ૧૯૩૭માં કુરાન મજીદનો અભ્યાસ શરૂ કર્યો હતો. આ “કુરાન-સાર”માં કુરાન મજીદના પહેલા પ્રકરણ “આરંભ” (સુરાહ અલ ફાતિહા)નું ગુજરાતી ભાષામાં ભાષાંતર આ પ્રમાણે થયેલું છે:

પ્રારંભ કરૂં છું. પરમાત્માના નામથી, જે પરમ કૃપાળુ અતિ કરૂણાવાન છે.

(૧) પ્રત્યેક સ્તુતિ પરમાત્માને માટે છે, જે સમસ્ત સંસારનો પાલનહાર છે.

(૨) પરમ કૃપાળુ, અતિ કરૂણાવાન.

(૩) અંતિમ દિનનો માલિક.

(૪) (હે પરમાત્મા), તારી જ અમે ભક્તિ કરીએ છીએ અને તારી પાસે જ યાચના કરીએ છીએ.

(૫) અમને સીધો રસ્તો બતાવ.

(૬) રસ્તો એ લોકોનો, જેમના પર દયા કરી છે.

(૭) ન કે એમનો, જેમના ઉપર તારો પ્રકોપ થયો, તેમજ ન એમનો, જેઓ ભ્રમિત થયા.

શ્રી વિનોબા ભાવે એ તૈયાર કરાવેલ “કુરાન-સાર”, જેમાંથી “સુરાહ અલ ફાતિહા”નું ઉપર પ્રમાણેનું ગુજરાતી ભાષાંતર લેવામાં આવેલ છે, તે એક લેખ “કુરાન-સારની કથા” માંથી લેવામાં આવેલ છે, જેના લેખક શ્રી અચ્યુતરાવ દેશપાંડે છે. ક્રમશ:

**Dr. Salim Kapadia** DDS

Dental Centre

SK

Your Perfect
Smile...Is Our Greatest
Satisfaction!**SERVICES**

- Smile Makeover
- Laser Teeth Whitening
- Dental Implants - Start to Finish
- Single Visit Root Canal
- Re-treatment of Failing Root Canal
- Surgical Wisdom Teeth Extraction
- Scaling & Root Planing
- White Tooth Colored Filling
- Implant Retained Dentures
- Complete & Partial Dentures
- Lumineers & Veneers
- Crown & Bridges (Zirconia & E.max)



1825 Markham Rd, Suite 102
Scarborough, ON M1B 4Z9
drsalimkapadiadental.com

416-321-3268**ભાવભીની શ્રદ્ધાંજલિ****SALEH HAFEJEE**

JUNE 14, 2021

સ્નેહનો સાગર સમા હર કોઈને પોતાના ગણી, પોતાના
પ્રેમાળ હૈયાથી ઓળખનારા, મુખ પર મધુર સ્મિત,
અંતરમાં ઊર્મિ, હૃદયથી ભોળા, સૌમ્ય સ્વભાવવાળા
આપના દિવ્ય આત્માને ઈશ્વર / અલ્લાહ
શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

He was originally from village Sanrod-India.
Was Current president of S.M.A - Masjid Abubakr
Siddique. He was a founding member of S.M.A
and served as a volunteer for over 25 years.
Big loss for our community.

**DIVINE YOGA**

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Gratitude Program

Every Thursday 9 PM

Join today on-ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor
416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta

